

તા. 31-12-06 સુધીમાં નિવૃત્ત થતા કર્મચારીઓને જ 2004-'07 ના

બ્લોકની રજાપ્રવાસરાહતની સવલત આપવા અંગે

ગુજરાત સરકાર, નાણાં વિભાગ, ઠરાવક્રમાંક : મસભ-102004-657-ચ,
સચિવાલય, ગાંધીનગર, તા. 26-8-2005

- વંચાણે લીધા : (1) નાણાં વિભાગનો ઠરાવક્રમાંક : મસભ-102001-368-ચ, તા. 1-5-2001.
(2) નાણાં વિભાગનો ઠરાવક્રમાંક : મસભ-102001-368-ચ, તા. 18-8-2003.
(3) નાણાં વિભાગનો ઠરાવક્રમાંક : મસભ-102001-યુઓ-1268-ચ, તા. 6-12-2003.
(4) નાણાં વિભાગનો ઠરાવક્રમાંક : મસભ-102004-657-ચ, તા. 17-8-2004.

ઠરાવ :

ઉપર વંચાણમાં દર્શાવેલ ક્રમાંક : (1), (2), (3) અને (4)ના ઠરાવો અન્વયે, રાજ્યના કર્મચારીઓને રજાપ્રવાસરાહત-વતનપ્રવાસરાહતની સવલત, તેમાં દર્શાવેલ શરતોને આધીન તા. 1-5-2001 ના ઠરાવથી બે વર્ષ માટે તથા તા. 18-8-2003ના ઠરાવથી વધુ એક વર્ષની મુદત માટે મોકૂફ રાખવામાં આવેલ. ત્યારબાદ વંચાણમાં લીધેલ ક્રમાંક : (3) અને (4) આગળના ઠરાવો અન્વયે તા. 31-8-2005 સુધીની મુદત દરમિયાન સરકારી સેવામાંથી વયનિવૃત્ત થનાર કર્મચારીઓ કે જેઓએ ઉક્ત હુકમોની રવાનગી અગાઉ રજાપ્રવાસરાહત બ્લોકવર્ષ : 2000-2003નો લાભ લીધેલ ન હોય તેમને રજાપ્રવાસરાહત-વતનપ્રવાસ-રાહત મોકૂફીના હુકમોમાંથી મુક્તિ આપવામાં આવેલ હતી.

2. તા. 31-8-2005 પછી સેવામાંથી વયનિવૃત્ત થતા કર્મચારીઓને રજાપ્રવાસરાહતનો લાભ મંજૂર કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે આથી ઠરાવવામાં આવે છે કે :

(1) રજાપ્રવાસરાહત-વતનપ્રવાસરાહતની સવલત તા. 31-8-2006 સુધી મોકૂફ રાખવાનું રાખવામાં આવે છે.

(2) તા. 31-12-2006 સુધીની મુદત દરમિયાન સેવામાંથી નિવૃત્ત થતા કર્મચારીઓને રજાપ્રવાસરાહત બ્લોકવર્ષ 2004-2007નો લાભ મંજૂર કરી શકાશે. પરંતુ સંબંધિત વયનિવૃત્ત થતા કર્મચારીઓ અગાઉ રજાપ્રવાસરાહત બ્લોકવર્ષ : 2000-2003 નો લાભ લીધેલ ન હોવો જોઈએ.

(3) રજાપ્રવાસરાહત અંગેની અન્ય શરતો યથાવત રહેશે.

ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

સહી, એચ. ડી. સેઈલર

ઉપસચિવ (સેવા) નાણાં વિભાગ